



## વડોદરા મહાનગરપાલિકા ગુમાસ્તાધારા શાખા

[www.vmc.gov.in](http://www.vmc.gov.in)

### જાહેરનામું

આથી વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ કાર્યરત સંસ્થાઓ જેવી કે,

- (૧) કોઇ ધંધો, વેપાર, ઉત્પાદન કરતી અથવા પત્રકારત્વને લગતું અથવા પ્રિન્ટીંગનું કોઇ કાર્ય કરતી અથવા બેકીંગ, વીમો, સ્ટોક અને શેર દલાલી અથવા વિનીમયનો ધંધો કરતી અથવા વ્યવસાય કરતી અથવા કોઇ ધંધા વેપાર અથવા વ્યવસાય અથવા ઉત્પાદનને લગતું અથવા તેને આનુષંગિક અથવા તેને સહાયક કોઇ કામ કરતી સંસ્થાઓ તેમજ (હોસ્પિટલ, દવાખાના, ચિકિત્સાલય, બહુચિકિત્સાલય, પ્રસુતિગૃહ અને તેવી બીજી સંસ્થા સહિત) કોઇ વ્યવસાયી ચિકિત્સક, સ્થપતિ, ઇજનેર, હિસાબનીશ, વેરા પરામર્શી/ સલાહકાર અથવા બીજા કોઇ તકનિકી અથવા વ્યવસાયી પરામર્શી/સલાહકારની કાર્યરત સંસ્થાઓ.
  - (૨) રજીસ્ટ્રેશન મંડળી/ટ્રસ્ટી (નફાના હેતુ માટે અથવા તેવા હેતુ વગર) કોઇ ધંધો, વેપાર અથવા વ્યવસાય કરતા અથવા તેને લાગતું અથવા તેને આનુષંગિક અથવા તેને સહાયક કોઇ કામ કરતા સખાવતી અથવા બીજા ટ્રસ્ટ,
  - (૩) કારખાના અધિનિયમ-૧૯૪૮ની જોગવાઈઓ લાગુ ન પડતી હોય તેવી દુકાન, સંસ્થા, નિવાસ માટેની હોટલ, રેસ્ટોરન્ટ, ભોજનગૃહ, નાટયગૃહ અથવા સાર્વજનિક વિનોદ અથવા મનોરંજનના બીજા સ્થળો અને
  - (૪) રાજ્ય સરકાર, રાજપત્રમાં જાહેરનામાંથી આ અધિનિયમના હેતુઓ માટે જાહેર કરે તેવી બીજી સંસ્થાઓએ,  
(અ) ગુજરાત દુકાનો અને સંસ્થાઓ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) અધિનિયમ-૨૦૧૯  
(બ) ગુજરાત દુકાનો અને સંસ્થાઓના (રોજગાર સેવાની શરતોનું નિયમન) નિયમો-૨૦૨૦નો અમલ કરવાનો રહેશે.
- ગુજરાત દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ-૧૯૪૮ હેઠળ નોંધાયેલ તેમજ બિન નોંધાયેલ તેમજ કાર્યરત થતી નવી સંસ્થામાં ૧૦ થી ઓછા કર્મચારી ધરાવતી સંસ્થાઓના માલિકો/ભાગીદારો/ડીરેક્ટરોએ ગુજરાત દુકાનો અને સંસ્થાઓ(રોજગાર અને સેવાની શરતોનું નિયમન) અધિનિયમ-૨૦૧૯ મુજબ જે તે વહીવટી વોર્ડમાં અરજી કરી ઇન્ટીમેશન રીસીપ્ટ મેળવી લેવાની રહેશે. આ અંગે કોઇપણ ફી ભરવાની રહેતી નથી. જ્યારે ૧૦ કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થાઓએ નીચે કોષ્ટકમાં દર્શાવેલ નિયત ફી ભરી જે તે વહીવટી વોર્ડમાં અરજી કરી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેનું અમલીકરણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૧થી કરવામાં આવનાર છે.

Sr. No.	Category of Establishment	Fees to be paid in Rs.
1	Establishments	500/-
2	Shops	500/-
3	Residential Hotels	2500/-
4	Restaurant and Eating Houses	1000/-
5	Theatres and other places of public amusement or entertainment	5000/-

- \* નવી કાર્યરત થતી સંસ્થાઓ/બિન નોંધાયેલ સંસ્થાઓએ કામકાજ શરૂ કર્યાના દિન ૬૦ માં ઉપર મુજબ ફરજિયાત ઇન્ટીમેશન/રજીસ્ટ્રેશન લેવાનું રહેશે.
  - \* ગુજરાત દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ-૧૯૪૮ હેઠળ મેળવેલ પ્રમાણપત્રો તેનાં તાજુ (રીન્યુ) કરાવ્યાની મુદત સુધી અમલમાં રહેશે.
  - \* જાહેરનામાનો ભંગ બદલ/અમલ ન કરવા બાબતે અધિનિયમની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  - \* આ અંગેની વધુ માહિતી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ [www.vmc.gov.in](http://www.vmc.gov.in) પરથી મળી રહેશે.
- પી.આર.ઓ નં:૭૮૨/૨૦-૨૧ મ્યુનિસિપલ કમિશનર